

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

## અગત્યની જાહેરાત

જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯

મંડળ દ્વારા સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, રોજગાર અને તાલીમ હસ્તકના જુદા જુદા સંવર્ગોની સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ ભરવા માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પૈકી જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી જા.ક. ૧૭૪/૨૦૧૮૧૯ તેમજ જા.ક. ૧૭૭/૨૦૧૮૧૯ થી જા.ક. ૧૭૯/૨૦૧૮૧૯ માં ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાત સંબંધેની નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગરના તા. ૨૦/૦૩/૨૦૧૯ તથા તા. ૨૭/૦૩/૨૦૧૯ ના પત્રોથી આપેલ સ્પષ્ટતા અન્વયે શૈક્ષણિક લાયકાત સંબંધે નીચે દર્શાવ્યા પ્રમાણેની કેટલીક વિશેષ સ્પષ્ટતા સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.

ઉક્ત જાહેરાતો અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાતોમાં ઉમેદવારો માટેની ત્રણ પ્રકાર-વિકલ્પની શૈક્ષણિક લાયકાત દર્શાવેલ છે. તે પૈકી ત્રીજા પ્રકાર-વિકલ્પની શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર ” નેશનલ એપ્રેન્ટીશશીપ સર્ટિફિકેટ (NAC) અથવા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC) અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ કોર્સ (જ્યાં ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેઇનીંગ કોર્સ ઉપલબ્ધ હોય તેવા ટ્રેડમાં) સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઇશે. અને તેવા સર્ટિફિકેટ કોર્સ પાસ કર્યા બાદનો સંબંધિત ટ્રેડનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.” એ પ્રમાણે દર્શાવેલ છે. જેના અર્થ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઉમેદવારે વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ સંબંધિત ગૃપના કોઇપણ ટ્રેડ પૈકી કોઇ એક ટ્રેડમાં નેશનલ એપ્રેન્ટીશશીપ સર્ટિફિકેટ (NAC) અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેઇનીંગ કોર્સ (NCITC) અથવા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC) અને નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેઇનીંગ કોર્સ (NCITC) પણ પાસ કરેલ હોવો ફરજિયાત છે. એટલે કે NAC નો કોર્સ પાસ કરેલ ઉમેદવારે તે સાથે NCITC નો કોર્સ પાસ કરેલ હોય તો જ તે ઉમેદવારી નોંધાવી શકે છે. તે જ રીતે NTC કોર્સ પાસ કરેલ ઉમેદવારે સાથે NCITC નો કોર્સ પાસ કરેલ હોય તો જ તે ઉમેદવારી નોંધાવી શકે છે. તેથી કોઇ ઉમેદવારે માત્ર NAC અથવા NTC નો કોર્સ પાસ કરેલ હોય પરંતુ તેની સાથે NCITC નો કોર્સ પાસ કરેલ ન હોય તો તેવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત માન્ય ગણી શકાતી ન હોવાથી તેવા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે નહીં અને તેમ છતાં તેવા કોઇ ઉમેદવારે ઉમેદવારી નોંધાવેલ હોય તો તે માન્ય ગણાતી ન હોવાથી આગળની ભરતી પ્રક્રિયામાં આપમેળે સામેલ ન થવાની સલાહ આપવામાં આવે છે / થવાનું રહેશે નહીં. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. ઓન-લાઇન એપ્લીકેશનના રજીસ્ટ્રેશનના પ્રોગ્રામમાં તે મુજબનું ફિલ્ડ મુકવામાં આવેલ છે.

સ્થળ:- ગાંધીનગર

તારીખ- ૨૯/૦૩/૨૦૧૯

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર